

24 જુલાઈ 2018

## 15 સ્થાનિક વિદ્યાર્થીઓ સમર કંપનીઓનો શુભારંભ કરી રહ્યા છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – આ ઉનાળામાં સ્થાનિક વિદ્યાર્થીઓનું એક જૂથ ઓન્ટ્રપ્રનરશીપમાં એટલેકે ઉદ્યોગ વેપારના સાહસ કરવામાં હાથ અજમાવી રહ્યા છે જે તેમની મહેનત અને બ્રેમ્પટન ઓન્ટ્રપ્રનર સેંટર અને સમર કંપની પ્રોગ્રામને આભારી છે.

બ્રેમ્પટન ઓન્ટ્રપ્રનર સેંટરનો સમર કંપની પ્રોગ્રામ તે 15 વિદ્યાર્થીઓ સાથે કામ કરશે જેથી તેમના બિઝનેસ આઇડિયાને વાસ્તવિક રૂપ આપી શકાય. સમર કંપની 15 થી 29 ની વયના વિદ્યાર્થીઓ માટેનો ઓન્ટારિયો સરકારનો પ્રોગ્રામ છે જે તેમને પોતાના ઉનાળાના વેપાર શરૂ કરવામાં મદદ કરે છે. પ્રોગ્રામ વાસ્તવિક તાલીમ, માર્ગદર્શન અને \$3000 સુધીની રકમના નાણાકીય અનુદાન પૂરા પાડે છે.

યુવા રોજગાર અને યુવા ઓન્ટ્રપ્રનરશીપ માટે નવી તકો સાકાર કરવામાં મદદ કરવી તે સીટીના [આર્થિક વિકાસ માસ્ટર પ્લાન \(Economic Development Master Plan\)](#)માં ચીંધાયેલ કાર્ય છે. પ્લાન નોકરીઓ, પ્રતિભાઓ અને મૂડી રોકાણ કરવા માટેનો આગામી 20 વર્ષનો રોડમેપ એટલેકે પૂર્વાયોજન છે. વ્યાપારમાં યુવા લોકોને પ્રત્યક્ષ અનુભવ કરવામાં મદદરૂપ થવું તે ભાવિ આર્થિક વૃદ્ધિ સાથે સીધું જોડાયેલું છે.

આ વર્ષના કાર્યક્રમોના વ્યવસાયોમાં ફોટોગ્રાફી, ક્લોથિંગ ડિઝાઇન અને છૂટક વેચાણ એટલેકે રિટેઇલ, કલા આધારિત વ્યવસાયો અને ગ્રાફિક ડિઝાઇનનો સમાવેશ થાય છે. સમર કંપની પ્રોગ્રામનો ભાગ હોય એવા માર્ગદર્શન અને તાલીમના સત્રોની સાથે વિદ્યાર્થીઓમાંથી સાહસિકો બનેલા હોય તેઓ પોતાનો સમય તેમના ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવામાં અને વ્યાપારની થોડી પ્રારંભિક આવક ઊભી કરવા માટે વહેંચી રહ્યા છે.

[આ વર્ષના સહભાગીઓ](#) ને બ્રેમ્પટન અને કેલેડન ખાતેથી 120 કરતા વધુ અરજદારોમાંથી પસંદ કરવામાં આવ્યા હતાં. સમર કંપની પ્રોગ્રામ વિશેની માહિતી અને સમર 2019 માટે અરજી કરવાના અપડેટ્સ માટે અહીં મુલાકાત લો [www.ontario.ca/summercompany](http://www.ontario.ca/summercompany).

બ્રેમ્પટન ઓન્ટ્રપ્રનર સેંટર આખું વર્ષ વ્યાપાર અને ઓન્ટ્રપ્રનરો એટલેકે સાહસિકોને મદદ કરતા ઇવેન્ટ્સ હાથ ધરે છે. તે વ્યક્તિગત પરામર્શ અને સલાહ પણ આપે છે અને ભંડોળ અને સ્ટાર્ટ-અપ તેમજ પ્રસ્થાપિત વ્યાપારોમાં મદદરૂપ થવાના કાર્યક્રમો સુધી પહોંચવાનું કેન્દ્રબિંદુ છે.

ક્વોટ:

"આ યુવા લોકો પોતાના વ્યવસાયોમાં જે જુસ્સો, સમર્પણ અને વ્યવસાયિકતા લાવે છે તે જોઈને અમને આનંદ થાય છે. ઈનોવેશન અને યુવા ઉદ્યોગસાહસિકતા મહત્વની છે અને અમારે આપણા યુવાનોને એવી તકો અને સમર્થન પૂરું પાડવું છે જે તેમને સફળ થવા માટે જરૂરી છે અને આ પ્રોગ્રામ બસ એ જ પૂરું પાડે છે."

- *બ્રમ્પટન મેયર લિન્ડા જેફી*

"અમે સમર કંપનીના વિદ્યાર્થીઓ પર ખૂબ જ રસપૂર્વક નજર રાખીશું. આ યુવા ઉદ્યોગસાહસિકોમાં બ્રમ્પટનની આર્થિક વૃદ્ધિ, રોજગાર અને મૂડી રોકાણને વેગ આપનારા બિઝનેસ આગેવાનોની નવી પેઢી સમાયેલી છે."

- *કાઉન્સિલર જેફ બોર્મેન, અધ્યક્ષ, ઇકોનોમિક ડેવેલપમેન્ટ*

"બ્રમ્પટનમાં ધંધાદારી સમુદાયને સીટી કેવી રીતે સમર્થન અને સેવા આપે છે તેનું બ્રમ્પટન ઓન્ટ્રપ્રનર સેન્ટર એક મહત્ત્વનું ઘટક છે. અમે વિકાસનો મજબૂત પાયો નાંખતા રોજગાર અને મૂડીરોકાણ પર અને સમર કંપની જેવા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે બ્રમ્પટન ઓન્ટ્રપ્રનર સેન્ટર મારફત આપવામાં આવે છે."

- *બોબ ડાર્લિંગ, ડાયરેક્ટર, બ્રમ્પટન ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર, સીટી ઓફ બ્રમ્પટન*

-30-

**બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે.** અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).